



## ત્વરિત જાહેરાત માટે

એકિટવેટ ડાઉનટાઉન બ્રેમ્પટન માટે માય મેઈન સ્ટ્રીટ કમ્યુનિટી એકિટવેટર પ્રોગ્રામના માધ્યમથી સિટી ઓફ બ્રેમ્પટનને મળે છે સમર્થન

બ્રેમ્પટન, ઓન્ટારિયો (10 જૂન 2022) – સિટી ઓફ બ્રેમ્પટન તેમના સહયોગીઓ ડાઉનટાઉન બ્રેમ્પટન બિઝનેસ ઇમ્પ્રૂવમેન્ટ એરિયા (BIA) અને 8.80 સિટીઝ સાથે એકિટવેટ ડાઉનટાઉન બ્રેમ્પટન માટે [માય મેઈન સ્ટ્રીટ કમ્યુનિટી એકિટવેટર પ્રોગ્રામના](#) માધ્યમથી \$223,650 પ્રાપ્ત કરવા પસંદ કરવામાં આવ્યા છે, જે ઇન્ટરએક્ટિવ ઇન્સ્ટોલેશનો અને સંગીતના કાર્યક્રમોની માલિકા છે જે ડાઉનટાઉન બ્રેમ્પટનની શેરીઓમાં અને જાહેર મેળાવડાના સ્થળો પર ઓક્ટોબર 2022 સુધી થવાના છે.

એકિટવેટ ડાઉનટાઉન બ્રેમ્પટનનો હેતુ સામાજિક કનેક્શન અને નાગરિક પ્રવૃત્તતાના અવસરો વધારવાનો છે અને જે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજીત કરશે. આ માલિકામાં સમાવેશ થશે સાપ્તાહિક સંગીત એકિટવેશનો જેમાં વિવિધ સ્થાનિક કલાકારો ભાગ લેશે જે રહેવાસીઓ અને બ્રેમ્પટનના મુલાકાતીઓ માણી શકે તે માટે શહેરની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને પ્રતિબિંબીત કરશે. આ એકિટવેશનો દર શનિવારે બપોરે 12 થી સાંજે 2 વાગ્યા સુધી હાથ ધરાશે જે ઓક્ટોબરની 15 તારીખ સુધી આખા ડાઉનટાઉનમાં થશે. સ્થળો [અહીં](#) જુઓ.

રહેવાસીઓ ડાઉનટાઉન બ્રેમ્પટનના જાહેર સ્થળોને જીવંત અને સક્રિય બનાવવા માટેપોતાની કલ્પનાઓ પણ રજૂ કરી શકશે જે તેઓ [એકિટવેટ ડાઉનટાઉન બ્રેમ્પટન](#) વેબસાઈટની મુલાકાત લઈને અથવા સમગ્ર ઉનાળા અને પાનખર દરમિયાન આ જાહેર સ્થળો પર પોપ-અપ પ્રસંગોમાં હાજર રહીને કરી શકશે.

માય મેઈન સ્ટ્રીટ કમ્યુનિટી એકિટવેટર [ફેડેરલ ઇકોનોમિક ડિવલપમેન્ટ એજન્સી ફોર સર્ધર્ન ઓન્ટારિયો \(FedDev Ontario\)](#)ના માધ્યમથી કેનેડા સરકાર દ્વારા થનાર \$23.25 મિલિયનનું રોકાણ છે જે [કેનેડિયન અર્બન ઇન્સ્ટિટ્યુટ \(CUI\)](#) અને [ઇકોનોમિક ડિવલપર્સ કાઉન્સિલ ઓફ કેનેડા \(EDCO\)](#) દ્વારા પ્રદાન કરવામાં આવી રહ્યું છે. એકિટવેટ ડાઉનટાઉન બ્રેમ્પટનના માધ્યમથી આ માલિકા વધુ ગતિશીલ ડાઉનટાઉન ઊભું કરવામાં મદદરૂપ થશે જે મુલાકાતીઓને અકર્ષી શકશે અને દુકાનો, રેસ્ટોરંટોમાં ગ્રાહકોના પગલાં વધારશે તેમજ રોમાંચક નવા જાહેર સ્થળો બનશે જેથી સ્થાનિક વ્યવસાયોને COVID-19માંથી ફરી બેઠા થવામાં મદદ કરશે.

### ઇન્ટિગ્રેટેડ ડાઉનટાઉન પ્લાન વિષયક

ડાઉનટાઉન બ્રેમ્પટન પરિવર્તિત થઈ રહ્યું છે, આ મહિનાની શરૂઆતથી રિજન ઓફ પીલ આ વિસ્તારમાં પાણીની મેઈન લાઈન અને ગટરો બદલવા માટેનું બાંધકામ હાથ ધરશે જેના પછી સિટી પોતાનું કાર્ય શરૂ કરશે જેમાં કુટપાથ બદલવા તથા પહોળા કરવા અને માર્ગોને રિસર્ફેસ કરવા તેમજ તેનું સમારકામ કરવાનો સમાવેશ થાય છે.

આ એક્ટિવેશનો સિટીના ઈન્ટિગ્રેટેડ ડાઉનટાઉન પ્લાનને (IDP) આગળ ધપાવવાનો ભાગ છે જે ડાઉનટાઉન બ્રેમ્પટનની અનેક ચાલુ રહેલ પહેલો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પરિયોજનાઓનું માર્ગદર્શન કરશે જેથી ભાવિ વિકાસ અને વ્યૂહાત્મક નિવેશને માર્ગદર્શન મળશે તેવી આશા સેવવામાં આવે છે.

IDPના માર્ગદર્શક સિદ્ધાંતો છે સમાવેશિતા, નવાચાર એટલેકે ઈનોવેશન અને સ્થિરતા. તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, શહેરી ડીઝાઇન, જમીનનો ઉપયોગ અને પ્રોગ્રામિંગ હસ્તક્ષેપોને સંકલિત કરવામાં મદદ મળશે - જેથી બ્રેમ્પટન એક અગત્યનો આર્થિક ચાલક, પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્ર અને ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ તરીકે ઉભરશે.

IDP પર વધુ માહિતી માટે, મુલાકાત લો [www.brampton.ca/IDP](http://www.brampton.ca/IDP)

ડાઉનટાઉન બ્રેમ્પટન પર વધુ માહિતી માટે, મુલાકાત લો [www.brampton.ca/downtownbrampton](http://www.brampton.ca/downtownbrampton).

## સુવાક્યો

અમારી સરકાર સમુદાયો પોતાની શેરીઓ ફરી જીવંત કરી શકે તેમાં મદદ કરવા પ્રતિબદ્ધ છે. માય મેઇન સ્ટ્રીટ એવી પરિયોજનાઓને મહત્વપૂર્ણ સહાય કરશે જે ઈન્સ્ટોલેશનો, ઈવેન્ટ્સ અને પ્રવૃત્તિઓના માધ્યમથી ફરી બધા નેબરહૂડ્ડસને ધમધમતા કરી દેશે જેમાં એવી પ્રવૃત્તિઓ થશે જે સમાવેશીત, નવીન અને પ્રવૃત્ત કરનારી હશે જે નવા રોજગાર ઊભા કરશે અને સ્થાનિક અર્થતંત્રમાં આર્થિક વિકાસ લાવશે.

- માનનીય હેલેના જેક્ઝેક, ફેડરલ ઈકોનોમિક ડિવલપમેન્ટ એજન્સી ફોર સર્ધર્ન ઓન્ટારિયો માટે જવાબદાર મંત્રી (ફેડરલ ઓન્ટારિયો)

"અમારા ભાગીદારો સાથે મળી અમે ડાઉનટાઉન બ્રેમ્પટનની સંભાવનાઓને પુનઃજીવંત કરવા અને ફરી શરૂ કરવા કાર્ય કરી રહ્યા છીએ જેનાથી એક ગુણવત્તાસભર શહેરી જગ્યાનું સર્જન થશે અને રાહદારીઓ માટેની ઉન્નત સૃષ્ટી ઊભી થઈ શકશે. આ ઉનાળામાં હું રહેવાસીઓને એએક્ટિવેટ ડાઉનટાઉન બ્રેમ્પટન ઈવેન્ટ્સમાં નિમંત્રિત કરું છું. અમે કેવી રીતે અમારી જાહેર જગ્યાઓ સુધારી શકીએ છીએ તેના પર તમારા વિચારોની આપલે કરો, જીવંત સંગીતનો આનંદ માણવા માટે શનિવારે અમારી સાથે જોડાઓ અને અમારા આશ્રયજનક સ્થાનિક વ્યવસાયોને સહયોગ આપવાનું ચાલુ રાખો."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"આપણા ડાઉનટાઉનના પુનરુત્થાન માટે સિટી ઓફ બ્રેમ્પટને પગલા લેવા ચાલુ રાખ્યા છે જેથી રહેવાસીઓ અને બ્રેમ્પટનના મુલાકાતીઓ માણી શકે એવા ધમધમતા જાહેર સ્થળો બનાવી શકાય. આવા મહત્વપૂર્ણ રોકાણ માટે અમે ફેડરલ ઓન્ટારિયોનો આભાર માનીએ છીએ અને અમારા સહયોગીઓ સાથે સહયોગ ચાલુ રાખવા ઉત્સુક છીએ જેથી વધુ ગતિશીલ ડાઉનટાઉનનું સર્જન થઈ શકે અને COVID-19માંથી બેઠા થઈ રહ્યા છે તેવા સમયમાં આપણા સ્થાનિક વ્યવસાયોને મદદરૂપ થઈ શકે."

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 અને 4; પ્રમુખ, ઇકોનોમિક ડિવલપમેન્ટ, સિટી ઓફ બ્રમ્પટન

"સિટી ઓફ બ્રમ્પટન ખાતે અમે અમારા રહેવાસીઓની જીવન ગુણવત્તા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ તેમજ સ્થાનિક વ્યવસાયોને સ્થાનિક રોકાણો અને ભાગીદારીઓના માધ્યમથી મદદરૂપ થવા પ્રતિબદ્ધ છીએ. એકિટવેટ ડાઉનટાઉન બ્રમ્પટન સામાજિક કનેક્શન અને નાગરિક પ્રવૃત્તાના અવસરો વધારશે અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજિત કરશે.

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

આ ઉનાળા અને પાનખરમાં અમારા ડાઉનટાઉનને સક્રિય કરવા માટે સિટી ઓફ બ્રમ્પટન અને 8.80 સિટીઝ સાથે સહયોગ સાધીને કાર્ય કરતા અમે અતિશય ઉત્સાહિત છીએ જેથી કમ્યુનિટી પ્લેસમેકિંગના પ્રયાસોના માધ્યમથી અમે અમારા જોરદાર સ્થાનિક વ્યવસાયોને મદદરૂપ થઈ શકીશું.

- કરી લીલ પરસિવલ (Carrie Leigh Percival), પ્રમુખ, ડાઉનટાઉન બ્રમ્પટન BIA

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](#).

**8.80 સિટીઝ** એક બિન-નફાકારક સંસ્થા છે જે કામગીરી શરૂ કરવાનું અને તમામ લોકો માટે તંદુરસ્ત, વધુ ન્યાયી અને ટકાઉ શહેરો બનાવવા માટે યથાવત્ સ્થિતિને પડકારવાનું મિશન ધરાવે છે. અમને દોરે છે એક સરળ પરંતુ શક્તિશાળી પ્રશ્ન - અમે અમારા શહેરો માટે કંઈક એવું કરી શકીએ જે બન્ને માટે એટલેકે એક 8 વર્ષીન તેમજ એક 80 વર્ષીન વ્યક્તિ માટે જોરદાર હોય તો કેવું? અમે માનીએ છીએ કે આ પ્રશ્નથી શરૂઆત કરીએ તો તેનાથી તમામ લોકો માટે મહાન શહેરો બનાવી શકાય. અમારી ટીમે આખા વિશ્વમામ 350 કરતા વધુ શહેરોમાં જાહેર સ્થળોમાં પરિવર્તન આણવા માટેના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કર્યા છે.

[ડાઉનટાઉન બ્રમ્પટન બિઝનેસ ઇમ્પ્રૂવમેન્ટ એરિયા](#) કમર્શ્યલ વિસ્તારોને ગતિશીલ વ્યવસાય અને શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરીકે પ્રોત્સાહિત કરે છે. વિશેષ ઈવેન્ટ્સ, જાહેરાત અને બ્યુટિકેશન પ્રોગ્રામ્સ દ્વારા, અમારું લક્ષ્ય છે કે તે વિસ્તારને લોકોના મનમાં ખરીદી કરવા માટે, મનોરંજન માટે, કામ કરવા માટે સૌથી અગ્રેસર, તેમજ એક આકર્ષક, સુખદ સ્થળ તરીકે રાખવાનું છે.

[કેનેડિયન અર્બન ઇન્સ્ટિટ્યુટ](#) એક રાષ્ટ્રીય ફલક છે જેમાં સામેલ છે કેનેડાના શહેરીકરણ માટે જે શ્રેષ્ઠ હોય તે — જ્યાં નીતિના નિર્માતાઓ, અર્બન વ્યવસાયિકો, નાગરિક અને વ્યવસાયના અગ્રણીઓ, સમાજના કાર્યકરો અને શિક્ષણવિદો જાણકારી મેળવી શકે, એકબીજા સાથે વિચારોની આપલે કરી શકે, સહયોગ સાધી શકે અને તે પણ એક કિનારેથી બીજા કિનારા સુધી. સંશોધન, પ્રવૃત્તા અને સ્ટોરીટેલિંગના માધ્યમથી અમારું મિશન તે સુનિશ્ચિત કરવાનું છે કે કેનેડા ગતિશીલ, સમાનતાયુક્ત, જીવી શકાય એવા અને સ્થિતિસ્થાપક શહેરોનું નિર્માણ કરે. અમને [Twitter](#), [Facebook](#) અને [લિંકડઇન](#) પર ફોલો કરો.

12 વર્ષ કરતા વધુ સમયથી કેનેડા સરકારે [FedDev ઓન્ટારિયો](#) ના માધ્યમથી દક્ષિણ ઓન્ટારિયોના અર્થતંત્રને ઉન્નત કરવા અને તેને અન્ય માર્ગે વાળવા માટે નીધિયનના અવસરોના માધ્યમથી અને એવી વ્યાપારિક સેવાઓના માધ્યમથી જે ઈનોવેશન, રોજગાર નિર્માણ અને કેનેડાના સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં કાર્ય કર્યું છે આ એજન્સીએ ખરેખર નોંધનીય પરિણામો પ્રદાન કર્યા છે જે દક્ષિણ ઓન્ટારિયોના વ્યવસાયોમાં જોઈ શકાય છે જેમણે ઈનોવેટિવ ટેકનોલોજી નિર્માણ કરી છે, ઉત્પાદન ક્ષમતામાં સુધારો કર્યો છે, તેમની આવકોમાં વિકાસ લાવ્યા છે, રોજગાર ઊભા કર્યા છે અને આખા પ્રદેશના સમુદાયોની આર્થિક પરિસ્થિતિમાં ઉન્નતિ લાવી શક્યા છે. એજન્સી દક્ષિણ ઓન્ટારિયોમાં કેવો પ્રભાવ પાડી રહી છે તે અંગે વધુ જાણકારી મેળવવા માટે અમારા [મુખ્ય પ્રોજેક્ટનું](#), અમારા [સંઘર્ન ઓન્ટારિયો સ્પોટલાઈટ](#), અને FedDev Ontarioના [Twitter](#), [Facebook](#), [Instagram](#) અને [LinkedIn](#)નું અવલોકન કરી શકો છો.

### મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા  
[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)

જીયા બેની  
પ્રોજેક્ટ મેનેજર, 8.80 સિટીઝ  
[jbenni@880cities.org](mailto:jbenni@880cities.org)  
647 800 5590

સુઝી ગોડફ્રોય (Suzy Godefroy)  
- સુઝી ગોડફ્રોય, એગ્રિજ્યુટિવ ડિરેક્ટર, ડાઉનટાઉન બ્રમ્પટન ક્ષેત્ર  
[Suzy.Godefroy@brampton.ca](mailto:Suzy.Godefroy@brampton.ca)

નિક હેન્સન  
કમ્યુનિકેશન્સ લીડ  
કેનેડિયન અર્બન ઈન્સ્ટિટ્યુટ  
[media@mymainstreet.ca](mailto:media@mymainstreet.ca)

મોનિકા ગ્રાનાડોસ  
પ્રેસ સ્કેટરી, માનનીય. હેલેના જેકઝેકની કચેરી  
ફેડેરલ ઈકોનોમિક ડિવલપમેન્ટ એજન્સી ફોર સંઘર્ન ઓન્ટારિયો  
માટે જવાબદાર મંત્રી  
[monica.granados@feddevontario.gc.ca](mailto:monica.granados@feddevontario.gc.ca)